

## વ्यवહारयारित्र અધિકાર

હવે વ्यવહારયારિત્ર અધિકાર કહેવામાં આવે છે.

આ, અહિંસાપ્રતના સ્વરૂપનું કથન છે.

જીવસ્થાન, માર્ગણાસ્થાન, યોનિ, કુલાદિ જીવનાં જાણીને,  
આરંભથી નિવૃત્તિરૂપ પરિણામ તે વ્રત પ્રથમ છે. ૫૬.

**અન્વયાર્થ :**—જીવોનાં કુળ, યોનિ, જીવસ્થાન, માર્ગણાસ્થાન  
વગેરે જાણીને તેમના આરંભથી નિવૃત્તિરૂપ પરિણામ તે પહેલું વ્રત છે.  
॥૫૬॥

આ, સત્યપ્રતના સ્વરૂપનું કથન છે.

વિદ્ધેષ-રાગ-વિમોહજનિત મૃષા તણા પરિણામને  
જે છોડતા મુનિરાજ, તને સર્વદા વ્રત દ્વિતીય છે. ૫૭.

**અન્વયાર્થ :**—રાગથી, દ્વેષથી અથવા મોહથી થતા મૃષા  
ભાષાના પરિણામને જે સાધુ છોડે છે, તને જ સદા બીજું વ્રત છે.  
॥૫૭॥

આ, ત્રીજા વ્રતના સ્વરૂપનું કથન છે.

નગરે, અરણ્યે, ગ્રામમાં કો વસ્તુ પરની દેખીને  
છોડે ગ્રહણપરિણામ જે, તે પુરખને વ્રત તૃતીય છે. ૫૮.

**અન્વયાર્થ :**—ગ્રામમાં, નગરમાં કે વનમાં પારકી વસ્તુને  
દેખીને જે (સાધુ) તને ગ્રહવાના ભાવને છોડે છે, તને જ ત્રીજું વ્રત  
છે. ॥૫૮॥

આ, ચોથા વ્રતના સ્વરૂપનું કથન છે.

**શ્રીરૂપ દેખી શ્રી પ્રતિ અભિવાષભાવનિવૃત્તિ જે,**  
**વા મૈથુનસંજ્ઞારહિત જે પરિણામ તે વ્રત તુર્ય છે. ૫૮.**

**અન્વયાર્થ :**—શ્રીઓનું રૂપ દેખીને તેમના પ્રત્યે વાંછાભાવની નિવૃત્તિ તે અથવા મૈથુનસંજ્ઞારહિત જે પરિણામ તે ચોથું વ્રત છે. ॥૫૮॥

અહીં (આ ગાથામાં) પાંચમા વ્રતનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે.

**નિરપેક્ષ ભાવન સહિત સર્વ પરિગ્રહોનો ત્યાગ જે,**  
**તે જાણવું વ્રત પાંચમું ચારિત્રભર વહનારને. ૬૦.**

**અન્વયાર્થ :**—નિરપેક્ષ ભાવનાપૂર્વક (અર્થાત् જે ભાવનામાં પરની અપેક્ષા નથી એવી શુદ્ધ નિરાલંબન ભાવના સહિત) સર્વ પરિગ્રહોનો ત્યાગ (સર્વપરિગ્રહત્યાગસંબંધી શુભભાવ) તે, ચારિત્રભર વહનારને પાંચમું વ્રત કર્યું છે. ॥૬૦॥

અહીં (આ ગાથામાં) ઈર્યાસમિતિનું સ્વરૂપ કર્યું છે.

**અવલોકી માર્ગ ધુરાપ્રમાણ કરે ગમન મુનિરાજ જે**  
**દિવસે જ પ્રાસુક માર્ગમાં, ઈર્યાસમિતિ તેહને. ૬૧.**

**અન્વયાર્થ :**—જે શ્રમણ પ્રાસુક માર્ગ દિવસે ધુરાપ્રમાણ આગળ જોઈને ચાલે છે, તેને ઈર્યાસમિતિ હોય છે. ॥૬૧॥

અહીં ભાષાસમિતિનું સ્વરૂપ કર્યું છે.

**નિજસ્તવન, પરનિંદા, પિશુનતા, હાસ્ય, કર્કશ વચનને**  
**છોડી સ્વપરહિત જે વઢે, ભાષાસમિતિ તેહને. ૬૨.**

**અન્વયાર્થ :**—પૈશૂન્ય (ચાડી), હાસ્ય, કર્કશ ભાષા, પરનિંદા

અને આત્મપ્રશંસારૂપ વચનો પરિયાગીને જે સ્વપરહિતરૂપ વચનો બોલે છે, તેને ભાષાસમિતિ હોય છે. ॥૬૨॥

અહીં એષણાસમિતિનું સ્વરૂપ કહ્યું છે. તે આ પ્રમાણે—

અનુમનન-કૃત-કારિતવિહીન, પ્રશસ્ત, પ્રાસુક અશાનને  
—પરદત્તને મુનિ જે ગ્રહે, એષણાસમિતિ તેહને. ૬૩.

**અન્વયાર્થ :**—પર વડે દેવામાં આવેલું, કૃત-કારિત-અનુમોદન  
રહિત, પ્રાસુક અને પ્રશસ્ત ભોજન કરવારૂપ જે સમ્યક્ આહારગ્રહણ  
તે એષણાસમિતિ છે. ॥૬૩॥

અહીં આદાનનિક્ષેપનસમિતિનું સ્વરૂપ કહ્યું છે. તે આ પ્રમાણે—

શાખાદિ ગ્રહતાં—મૂકૃતાં મુનિના પ્રયત્ન પરિણામને  
આદાનનિક્ષેપણ સમિતિ કહેલ છે આગમ વિષે. ૬૪.

**અન્વયાર્થ :**—પુસ્તક, કમંડળ વગેરે લેવા-મૂકૃવા સંબંધી  
પ્રયત્નપરિણામ તે આદાનનિક્ષેપણસમિતિ છે એમ કહ્યું છે. ॥૬૪॥

આ, મુનિઓને કાયમળાદિત્યાગના સ્થાનની શુદ્ધિનું કથન છે.

જે ભૂમિ પ્રાસુક, ગૂઢ ને ઉપરોધ જ્યાં પરનો નહીં,  
મળત્યાગ ત્યાં કરનારને સમિતિ પ્રતિષ્ઠાપન તણી. ૬૫.

**અન્વયાર્થ :**—જેને પરના ઉપરોધ વિનાના (-બીજાથી  
રોકવામાં ન આવે એવા), ગૂઢ અને પ્રાસુક ભૂમિપ્રદેશમાં મળાદિનો  
ત્યાગ હોય, તેને પ્રતિષ્ઠાપન સમિતિ હોય છે. ॥૬૫॥

આ, વ્યવહાર મનોગુપ્તિના સ્વરૂપનું કથન છે.

કાલુષ્ય, સંજ્ઞા, મોહ, રાગ, દ્વેષ આદિ અશુભના  
પરિહારને મનગુપ્તિ છે ભાખેલ નય વ્યવહારમાં. ૬૬.

**અન્વયાર્થ :**—કલુષતા, મોહ, સંજ્ઞા, રાગ, દ્વેષ વગેરે અશુભ ભાવોના પરિહારને વ્યવહારનયથી મનોગુપ્તિ કહેલ છે. ॥૬૬॥

અહીં વચનગુપ્તિનું સ્વરૂપ કહ્યું છે.

સ્ત્રી-રાજ-મોજન-ચોરકથની હેતુ છે જે પાપની તસુ ત્યાગ, વા અલીકાદિનો જે ત્યાગ, ગુપ્તિ વચનની. ૬૭.

**અન્વયાર્થ :**—પાપનાં હેતુભૂત એવાં સ્ત્રીકથા, રાજકથા, ચોરકથા, ભક્તકથા ઈત્યાદિરૂપ વચનોનો પરિહાર અથવા અસત્યાદિકની નિવૃત્તિવાળાં વચનો તે વચન-ગુપ્તિ છે. ॥૬૭॥

અહીં કાયગુપ્તિનું સ્વરૂપ કહ્યું છે.

વધ, બંધ ને છેદનમયી, વિસ્તરણ-સંકોચનમયી ઈત્યાદિ કાયક્રિયા તણી નિવૃત્તિ તનગુપ્તિ કહી. ૬૮.

**અન્વયાર્થ :**—બંધન, છેદન, મારણ (-મારી નાખવું), આઙુંચન (-સંકોચવું) તથા પ્રસારણ (-વિસ્તારવું) ઈત્યાદિ કાયક્રિયાઓની નિવૃત્તિને કાયગુપ્તિ કહી છે. ॥૬૮॥

આ, નિશ્ચયનયથી મનોગુપ્તિની અને વચનગુપ્તિની સૂચના છે.

મનમાંથી જે રાગાદિની નિવૃત્તિ તે મનગુપ્તિ છે;  
અલીકાદિની નિવૃત્તિ અથવા મૌન વાચાગુપ્તિ છે. ૬૯.

**અન્વયાર્થ :**—મનમાંથી જે રાગાદિની નિવૃત્તિ તેને મનોગુપ્તિ જાણ. અસત્યાદિની નિવૃત્તિ અથવા મૌન તે વચનગુપ્તિ છે. ॥૬૯॥

આ, નિશ્ચયશરીરગુપ્તિના સ્વરૂપનું કથન છે.

જે કાયકર્મનિવૃત્તિ કાયોત્સર્ગ તે તનગુપ્તિ છે;  
હિંસાદિની નિવૃત્તિને વળી કાયગુપ્તિ કહેલ છે. ૭૦.

**અન્વયાર્થ :**—કાયક્રિયાઓની નિવૃત્તિરૂપ કાયોત્સર્ગ શરીરસંબંધી ગુપ્તિ છે; અથવા હિંસાદિની નિવૃત્તિને શરીરગુપ્તિ કહી છે. ॥૭૦॥

આ, ભગવાન અર્હત્ત પરમેશ્વરના સ્વરૂપનું કથન છે.

ઘનધાતિકર્મ વિહીન ને ચોત્રીસ અતિશય યુક્ત છે,  
કેવળજ્ઞાનાદિક પરમગુણ યુક્ત શ્રી અર્હત છે. ૭૧.

**અન્વયાર્થ :**—ઘનધાતીકર્મ રહિત, કેવળજ્ઞાનાદિ પરમ ગુણો સહિત અને ચોત્રીશ અતિશય સંયુક્ત;—આવા, અર્હતો હોય છે. ॥૭૧॥

સિદ્ધિના પરંપરાહેતુભૂત એવા ભગવંત સિદ્ધપરમેષ્ઠીઓનું સ્વરૂપ અહીં કહ્યું છે.

છે અષ્ટ કર્મ વિનષ્ટ, આષ મહાગુણો સંયુક્ત છે,  
શાશ્વત, પરમ ને લોક-અગ્રવિરાજમાન શ્રી સિદ્ધ છે. ૭૨.

**અન્વયાર્થ :**—આઠ કર્મના બંધને જેમણે નષ્ટ કરેલ છે એવા, આઠ મહાગુણો સહિત, પરમ, લોકના અગ્રે સ્થિત અને નિત્ય;—આવા, તે સિદ્ધો હોય છે. ॥૭૨॥

અહીં આચાર્યનું સ્વરૂપ કહ્યું છે.

પરિપૂર્ણ પંચાચારમાં, વળી ધીર ગુણગંભીર છે,  
પંચેદ્રિગજના દર્પદલને દક્ષ શ્રી આચાર્ય છે. ૭૩.

**અન્વયાર્થ :**—પંચાચારોથી પરિપૂર્ણ, પંચેદ્રિયરૂપી હાથીના મદનું દલન કરનારા, ધીર અને ગુણગંભીર;—આવા, આચાર્યો હોય છે. ॥૭૩॥

આ, અધ્યાપક (અર્થાત્ ઉપાધ્યાય) નામના પરમગુરુના સ્વરૂપનું કથન છે.

રત્નત્રયે સંયુક્ત ને નિઃકંકશભાવથી યુક્ત છે,  
જિનવરકથિત અર્થોપદેશે શૂર શ્રી ઉવજાય છે. ૭૪.

**અન્વયાર્થ :**—રત્નત્રયથી સંયુક્ત, જિનકથિત પદાર્થોના શૂરવીર ઉપદેશક અને નિઃકંકશભાવ સહિત;—આવા, ઉપાધ્યાયો હોય છે. ॥૭૪॥

આ, નિરંતર અખંડિત પરમ તપશ્ચરણમાં નિરત (-લીન) એવા સર્વ સાધુઓના સ્વરૂપનું કથન છે.

નિર્ગંથ છે, નિર્માહ છે, વ્યાપારથી પ્રવિમુક્ત છે,  
ચૌવિધ આરાધન વિષે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે. ૭૫.

**અન્વયાર્થ :**—વ્યાપારથી વિમુક્ત (—સમસ્ત વ્યાપાર રહિત), ચતુર્વિધ આરાધનામાં સદા રક્ત, નિર્ગંથ અને નિર્માહ;—આવા, સાધુઓ હોય છે. ॥૭૫॥

આ, વ્યવહારચારિત્ર-અધિકારનું જે વ્યાખ્યાન તેના ઉપસંહારનું અને નિશ્ચયચારિત્રની સૂચનાનું કથન છે.

આ ભાવનામાં જાણવું ચારિત્ર નય વ્યવહારથી;  
આના પછી ભાખીશ હું ચારિત્ર નિશ્ચયનય થકી. ૭૬.

**અન્વયાર્થ :**—આવી (પૂર્વોક્ત) ભાવનામાં વ્યવહારનયના અભિપ્રાયે ચારિત્ર છે; નિશ્ચયનયના અભિપ્રાયે ચારિત્ર આના પછી કહીશ. ॥૭૬॥

આ રીતે, શ્રીમદ્ભગવત્કુંદાચાર્યટેવપ્રાણીત શ્રી નિયમસાર પરમાગમનો વ્યવહારચારિત્ર અધિકાર નામનો ચોથો શુતસ્કંધ સમાપ્ત થયો.

